



MAN-001-001557

Seat No. _____

B. A. (Sem. V) (CBCS) Examination

October / November – 2016

Economics : Paper - XIV

(International Economics) (Old Course)

Faculty Code : 001

Subject Code : 001557

Time : $2\frac{1}{2}$ Hours]

[Total Marks : 70

- સૂચના : (૧) આંતરિક વિકલ્પના આધારે બધા પ્રશ્નોના ઉત્તર આપો.
 (૨) જમણી બાજુના અંક જે તે પ્રશ્નના પૂરા ગુણ દર્શાવે છે.
 (૩) જરૂર જણાય ત્યાં આકૃતિ દોરો.

૧ આંતરરાષ્ટ્રીય વ્યાપારનો તુલનાત્મક ખર્ચનો સિદ્ધાંત સમજાવી તેની સમીક્ષા કરો. ૧૪

અથવા

૧ આંતરરાષ્ટ્રીય વ્યાપારના લાભાલાભ ચર્ચો. ૧૪

૨ લેણદેણની તુલાનો અર્થ સમજાવી લેણદેણની તુલામાં ખાધ માટેનાં કારણો જણાવી લેણદેણની તુલાની અસમતુલા નિવારવાના ઉપાયો ચર્ચો. ૧૪

અથવા

૨ વિનિમયદર નિર્ધારણનો માંગ-પુરવઠાનો સિદ્ધાંત સમજાવી તેની સમીક્ષા કરો. ૧૪

૩ પરિવર્તનશીલ વિનિમયદર એટલે શું ? તેની તરફેણની દલીલો દર્શાવો. ૧૪

અથવા

૩ મુક્ત વ્યાપારના લાભાલાભ ચર્ચો. ૧૪

૪ વિનિમય દર નિર્ધારણનો સમખરીદશક્તિનો સિદ્ધાંત સમજાવી તેની સમીક્ષા કરો. ૧૪

અથવા

૪ બાળ ઉદ્યોગની સંરક્ષણની અને રોજગારીના સર્જનની દલીલો તપાસો. ૧૪

૫ ટ્રેકનોંધ : (કોઈ પણ બે) ૧૪

- (૧) વિનિમય અંકુશના હેતુઓ
 (૨) આંતર પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય વ્યાપારનો તફાવત સમજાવો
 (૩) વિદેશી હુંડિયામણ દરને અસર કરતાં પરિબળો
 (૪) સ્થિર વિનિમય દરની તરફેણની દલીલો.

ENGLISH VERSION

- Instructions :** (1) Answer all the questions on the basis of internal options.
(2) Right side figures show the total marks of the question.
(3) Draw diagrams if necessary.

- 1 Explain and review the comparative cost theory of international trade. 14

OR

- 1 Discuss the advantages and disadvantages of international trade. 14
- 2 Explain the meaning of balance of payment and state the causes for the deficit in the balance of payment and show the remedies to eliminate the deficit in balance of payment. 14

OR

- 2 Explain the demand-supply theory of exchange rate determination. 14
- 3 What is meant by the flexible exchange rate ? Show the arguments in its favour. 14

OR

- 3 Discuss the advantages and disadvantage of free trade. 14
- 4 Explain and evaluate the purchasing power parity theory regarding exchange rate determination. 14

OR

- 4 Examine the arguments favouring the protection for infant industry and creating employment. 14
- 5 Write short notes : (any two) 14
- (1) Objectives of exchange control
 - (2) Explain the difference between inter-regions trade and international trade.
 - (3) Factors affecting foreign exchange rate
 - (4) Arguments favouring the fixed exchange rate.